



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા ૧૯/૦૭/૨૦૧૯ શુક્રવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં. ૧૨૦૮/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૬ કેસ કરી, ૪૬ વ્યક્તિઓને ઝડપી, ૧૩૭ લીટર દેશી દારૂ, ૩૩૮ બોટલ ઈંગ્લીશ દારૂ અને ૧ મોટર સાયકલ કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૪ કેસ કરી, ૧૦ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૨,૪૧૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં. ૧૨૦૯/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી. ૧૦૭, ૧૦૯, ૧૧૦, ૧૫૧ મુજબ કુલ ૧૮૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી.૯૩ મુજબ ૮ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં. ૧૨૧૦/૧૯

સાબરમતી: ગીતાબહેન ડો/ઓ નાથાલાલ પંચાલ (ઉ.વ. ૪૮) (રહે. સ્વાગત રેસીડેંસી મોટેરા રોડ, સાબરમતી) એ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા. ૨૧/૦૪/૨૦૧૨ થી આજદીન સુધીના સમયગાળા દરમિયાન સાબરમતી, ડી-કેબીન ન્યુ સીંધુ સોસાયટી ખાતે આરોપી (૧) પિતામ્બર તારાચંદ મંગલાણી અને (૨) મીનાબહેન પીતામ્બર મંગલાણી (બંને રહે. ન્યુ સીંધુ સોસાયટી ડી-કેબીન સાબરમતી) એ ભેગા મળી ગીતાબહેન ને ધંધામા નાણાંનું રોકાણ કરવાનું જણાવી, લાલચ આપી તેમની પાસેથી રૂપિયા ૫,૦૦,૦૦૦/- મેળવી લઈ, પરત નહીં આપી ગીતાબહેન સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એચ.એમ.રાઠોડ ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં. ૧૨૧૧/૧૯

વાસણા: બીનાબહેન વા/ઓ વિનોદચન્દ્ર શાહ (રહે. પનામા સોસાયટી ઘરડાઘર સામે ચન્દ્રનગર વાસણા) એ વાસણા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા. ૧૭/૦૭/૧૯ રાતના ૮/૦૦ થી તા. ૧૮/૦૭/૧૯ કલાક ૭/૩૦ વાગ્યા દરમિયાન પોતાના મકાનના દરવાજાનો નકુચો તોડી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, સોના-મોતીની માળા, ચાંદીનો ઝાસ, ચાંદીની રકાબી, એક જોડી ઝાંઝર, એક જોડી સોનાની બુટ્ટી અને રોકડ રૂપિયા ૩૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૬૨,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.બી.પરમાર ચલાવે છે.

પાલડી: અદનાન સૈફુદ્દીન સફરી (રહે. વ્હોરવાડ, તાહી એપાર્ટમેન્ટ, ગાયકવાડ હવેલી પાસે, રાયખડ) એ પાલડી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૭/૦૭/૧૯ રાતના ૧૦/૩૦ થી તા.૧૮/૦૭/૧૯ કલાક ૭/૪૫ વાગ્યા દરમ્યાન પાલડી રાજનગર ચાર રસ્તા પાસે આવેલ રાજનગર કોમ્પ્લેક્ષ ખાતે આવેલ પોતાની “રેમેડી મેડીસીન્સ” નામથી દવાની દુકાનના શટરનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ દુકાનમાં પ્રવેશ કરી, રોકડ રૂપિયા ૫,૦૦૦/- તથા અલગ બ્રાંડની દવાઓ કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૫૫,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.જે.કરપડા ચલાવે છે.

એલીસબ્રીજ: સહાબુદ્દીન શમસુદ્દીન શેખ (રહે.પહેલો માળ, પાર્ક પોઇન્ટ ફ્લેટ, પારસબાગ સોસાયટી, કાગદીવાડ, એલીસબ્રીજ) એ એલીસબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૮/૦૭/૧૯ બપોરના ૧૨/૦૦ થી ૩/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ૧,૫૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૨,૫૦,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી એ.એસ.પટેલ ચલાવે છે.

ઘાબા ઉપરથી પડી જતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૨૧૨/૧૯

દાણીલીમડા: પુજાભાઈ માવજીભાઈ વાજા (ઉ.વ.૭૫)(રહે.ચંદન એસ.બી.આઈ સ્ટાફ સોસાયટી, બહેરામપુરા) એ અગમ્ય કારણસર તા.૧૮/૦૭/૧૯ કલાક ૧/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરના ઘાબા ઉપરથી નીચે પડી જતા, ગંભીર ઇજાઓ થતા સારવાર માટે તેમને એસ.વી.પી.હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પરના ડૉ.શ્રીએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે દાણીલીમડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી મગનભાઈ સબળાજી ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૨૧૩/૧૯

ખોખરા: પાયલ ઉર્ફે પીયા બળદેવભાઈ વડાદરા (ઉ.વ.૧૬)(રહે.મદ્રાસી સોસાયટી હાટકેશ્વર ખોખરા) એ અગમ્ય કારણસર તા.૧૮/૦૭/૧૯ બપોરના ૩/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે છતના હુકમાં સાડી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ખોખરા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી આર.પી મકવાણા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.